

જાહેરખબર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ,
બ્લોકનં.૪, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ ૨૦૨૨-૨૩)

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી- વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા.૧૬/૦૬/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ની આ યોજનાની ઓનલાઇન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લંક્ષ્યાક કરતા વધારે પ્રમાણ હોવાથી સરકારશ્રી દ્વારા આવી મંજૂર કરવાપાત્ર અરજીઓ વર્ષ ૨૦૨૨-૨૩ માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. જે ધ્યાને લેતા નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લંક્ષ્યાક સામે પુરતા પ્રમાણમાં જાતિવાઈઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારોએ ઓનલાઇન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવી.

- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે દાહોદ,પાટણ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ ૨૦૨૨-૨૩ લંક્ષ્યાક સામે પર્યાપ્ત હોઈ આ જિલ્લાઓમાં ઓનલાઇન અરજીઓ મંગાવવાની થતી નથી. આ ૭ (સાત) જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના અરજદારો અરજી કરી શકશે.
- આર્થિક પછાતવર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઇન અરજી કરી શકશે.વિચરતી-વિમુક્ત જાતિ માટે લંક્ષ્યાક પુર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઇન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે.
- આ સમયગાળા દરમ્યાન જે જિલ્લામાં લંક્ષ્યાક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે. જેથી અરજદારો ઓનલાઇન પોર્ટલ જોતા રહેવું.

- (૧) વર્ષ ૨૦૨૧-૨૨માં જે અરજદારો અરજી કરેલ હતી અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરેલ ન હતા તેવી અરજીઓ જિલ્લા કચેરી દ્વારા પુર્તતા કરવા માટે જે અરજદારને સેન્ડબેક કરેલ હતી અને અરજદારે આ અરજીની પુર્તતા કરીને જિલ્લા કચેરીને ઓનલાઇન મોકલેલ નથી તેવી સેન્ડબેક અરજીઓ અરજદારે દિન-૧૦ પુર્તતા કરીને ઓનલાઇન પરત મોકલવાની રહેશે. ત્યારબાદ આ અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે.
- (૨) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
- (૩) અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજૂર) ગણાશે.
- (૪) અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- (૫) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
- (૬) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિં.
- (૭) આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
- (૮) જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના/ આપવાના રહેશે.
- (૯) ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
- (૧૦) અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઈટ જોતા રહેવું.
- (૧૧) અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઈ હક્કદાવો કરી શકાશે નહીં.
- (૧૨) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- (૧૩) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

સ્થળ:- ગાંધીનગર
તા.૧૪/૦૬/૨૦૨૨

(એન.એ.નિનામા IAS)
નિયામક
વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર

